

-: અખબારી યાદી:-

રાજકોટ મહાનગરપાલિકાની હાઈસ્કૂલો દ્વારા મણીયાર હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

તારીખ: ૦૮-૦૧-૨૦૧૯



રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ, એકનાથ રનાડે વિદ્યાલય, શ્રી વીર સાવરકર વિદ્યાલય, શ્રી મુરલીધર વિદ્યામંદિર, શ્રી મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ (૦૬) શાળાના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ શિશિરાનંદોત્સવ - ૨૦૧૮-૨૦૧૯ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીની ઉપસ્થિતિમાં શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે તા. ૦૭-૦૧-૨૦૧૯ ના રોજ યોજાયો હતો.

મ્યુનિ. કમિશનરશ્રીએ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના દરેક શાળાના પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન (શિલ્ડ) આપવામાં આવ્યા હતા, તેમજ મ્યુનિ. કમિશનરશ્રીએ વિદ્યાર્થીઓને ત્રણ વાત ૧. કર્મ, ૨. કલા અને ૩. વિદ્યા નું ધ્યાન રાખવા જણાવ્યું હતું. દરેક વિદ્યાર્થી સખત મેહનત કરી ઉચ્ચ પરિણામ લાવી પોતાનો ગોલ સિદ્ધ કરે અને કોર્પોરેશન શાખાના વિદ્યાર્થીઓ ૯૯ P.R. ગુણાંક મેળવે છે તે અભિનંદનીય છે. પોતે સરકારી શાખામાં ભણીને આઈ.એ.એસ. બનેલ છે.

વધુમાં કમિશનરશ્રીએ વિદ્યાર્થીઓને જણાવેલ કે, સરકારની ગ્રાન્ટેડ શાળાઓ શ્રેષ્ઠ હોય છે, વિદ્યાર્થીએ પોતે સારી મહેનત કરી સાટું પરિણામ લાવવું જોઈએ. રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરાવવા માટે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અપીલ કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી એકનાથ રનાડે વિદ્યાલયના એક વિદ્યાર્થી અશ્વિન કુશવાહાને વિજ્ઞાનના પ્રોજેક્ટમાં રાષ્ટ્રીયકક્ષાએ પુરસ્કાર મળેલ હતો તેને મ્યુનિ. કમિશનરશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. શિશિરાનંદોત્સવ ઉદઘાટન પ્રસંગે આસી. મ્યુનિ. કમિશનરશ્રી આર. એન. ચુડાસમા, સુરક્ષા અધિકારી શ્રી આર, બી, ઝાલા, પૂર્વ કોર્પોરેટરશ્રી અનિલભાઈ લીંબડ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અન્વેષક શ્રી બી.ડી. જાડેજા તેમજ સર્વે આચાર્યો ડો. તુષારભાઈ પંડ્યા, ડો. સોનલબેન ફળદુ, વિ.પી. ગાજીપરા, આશિષભાઈ પાઠક, હિતેશભાઈ ચાવડા તેમજ હંસાબેન આહ્યા હાજર રહ્યા હતા.

૦૬ સ્કુલની કુલ- ૧૦ કૃતિઓ કરવામાં આવી હતી, અને ધો-૧૦ તથા ધો-૧૨ના ત્રીસ વિદ્યાર્થીઓ (પ્રથમ, દ્વિતીય, તૃતીય) ને પુરસ્કાર (શિલ્ડ) આપવામાં આવ્યા હતા. શ્રી ઝાલા સાહેબ વિદ્યાર્થીઓને મેહનત કરી પ્રગતિ કરવાની શુભકામના આપી હતી. શ્રી બી.ડી. જાડેજાએ કોર્પોરેશન સંચાલિત ૦૬ હાઈસ્કુલના ટીમ વર્કની, વિદ્યાર્થી, તેમજ સ્ટાફની પ્રસંસા કરી હતી.

કૃતિઓ:

(૧) સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ

સ્વચ્છતા મેલોડી - ડાન્સ

જલતે દિયે - ડાન્સ

(૨) એકનાથ રનાડે વિદ્યાલય

છોગાડા - ડાન્સ

(૩) શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ

યુ.આર. અન્ડર અરેસ્ટ અને 'પીસ'

બે માઇસ તથા દ્વારકામાં ટીવા બળે - રાસ

(૪) મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયની

પ્રજ્ઞાયક્ષુ બહેનો દ્વારા દેશ ભક્તિ ગીત પર ડાન્સ

બેટી બચાવો પર ડાન્સ તથા મિક્સ મેલોડી ડાન્સ

(૫) મુરલીધર વિદ્યામંદિરનું સ્વાગત ગીત હતું.

(૬) વીર સાવરકર વિદ્યાલય

દેશ ભક્તિ ગીત પર ડાન્સ

ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડો. તુષારભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ ડો. સોનલબેન ફળદ્દ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાત વિષે ખુબ સુંદર વક્તવ્ય શ્રી એકનાથ રનાડેનીપૂર્વ વિદ્યાર્થીની પટેલ અમૃતાએ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શાળાના આચાર્યો, શૈક્ષણિક તેમજ બીનશૈક્ષણિક કર્મચારીએ જહેમત ઉઠાવી હતી.

(જન સંપર્ક અધિકારી)